

—:: બાબત ::—

આ કરાર આજરોજ તારીખ સને બે હજારના રોજ " શ્રીજી બિલ્ડર્સ" ના અધિકૃત ભાગીદાર (૧) શ્રી શૈલેષકુમાર કરશનભાઈ બુટાણી, (૨) શ્રી પુનીતકુમાર મગનભાઈ બુટાણી, (૩) શ્રી દિનેશભાઈ લીંબાભાઈ બફલીપરા, (૪) શ્રી કપીલભાઈ કેશવભાઈ અંકોલા, (૫) શ્રી જયંતીલાલ નાથાભાઈ કાવઠીયા, (૬) શ્રી સંજય ગોરધનભાઈ જાકાસણીયા, (૭) શ્રી દિવ્યાબેન બાબુલાલ ડેડકીયા, (૮) શ્રી રશ્મિ પ્રવિણ પટેલ, (પાનકાર્ડ નં.AECFS3699R), પેઢીનું સરનામું. અક્ષર પ્લાઝા-૨, પહેલા માળે, ઝાંઝરડા ક્રોસ રોડ નજીક, બાયપાસ, જુનાગઢ, ગુજરાત-૩૬૨૦૦૧ જેઓને હવે પછી આ કરારમાં એક તરફવાળા - પ્રયોજક તરીકે સંબોધવામાં આવશે અને રહે. જેઓને હવે પછી આ કરારમાં બીજી તરફવાળા-ફાળવણીથી મેળવનારા તરીકે સંબોધવામાં આવશે, ની વચ્ચે કરવમાં આવે છે.

/૧/ ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લાના જુનાગઢ તાલુકાના ગામ મોજે જુનાગઢના રેવન્યુ સરવે નંબર-૧૨૨/૨ પૈકીની જમીન મુળ બારખલીદાર દાતાર ખલીફા કાદરમીયા બક્ષુમીયાને નામે ગણોતધારા નીચે આવેલ હતી. આ બાબતની નોંધ ગામ નમુના નંબર-૬ હકક પત્રકે નોંધ નંબર-૧૫૧, તા.૧/૮/૧૯૫૧ થી થયેલ છે અને ત્યારબાદ સદરહુ દાતાર ખલીફા કાદરમીયા બક્ષુમીયાના નામે આવેલ જમીનનું ફેસલ પત્રક ભરાઈ આવતા સદરહુ જમીન એકર ૧૧-૧૦ ગુંઠા જમીન તેના ખેડનાર ખેડુત કણબી દેવસીભાઈ ભીમાભાઈના નામે થયેલ હતી. આ બાબતની નોંધ ગામ નમુના નંબર-૬ હકક પત્રકે નોંધ નંબર-૨૫૪, તા.૧૧/૧૦/૧૯૫૬ થી થયેલ છે.

/૨/ ત્યારબાદ સદરહુ રેવન્યુ સરવે નંબર-૧૨૨/૨ પૈકી એકર ૧૧-૧૦ ગુંઠાની જમીનના માલીક શ્રી દેવસીભાઈ ભીમાભાઈએ તેમના વારસદાર પુત્રો વચ્ચે ભાઈઓ ભાગની વહેંચણી કરતા સદરહુ સર્વે નંબર-૧૨૨/૨ પૈકી એકર ૪-૩૬ ગુંઠા જમીન શ્રી બાવનભાઈ દેવસીભાઈના ભાગમાં આવેલ હતી. આ બાબતની નોંધ ગામ નમુના નંબર-૬ હકક પત્રકે નોંધ નંબર-૧૨૮૧ થી થયેલ છે.

/૩/ ત્યારબાદ શ્રી બાવનભાઈ દેવસીભાઈના ભાગમાં આવેલ ખેતીની જમીનમાંથી સદરહુ રેવન્યુ સરવે નંબર-૧૨૨/૨ પૈકી એકર ૧-૨૪ ગુંઠાની ખેતીની જમીન શ્રી બાવનભાઈ દેવસીભાઈ પાસેથી અનુ.નં. ૩૭૬૨, તા.૧૫/૭/૧૯૮૮ ના રજી. વેચાણ દસ્તાવેજથી શ્રી અરશીભાઈ જગમલભાઈએ ખરીદ કરેલ. આ બાબતની નોંધ ગામ નમુના નંબર-૬ હકક પત્રકે નોંધ નંબર-૮૫૭૮ થી થયેલ છે.

/૪/ ત્યારબાદ સદરહુ રેવન્યુ સરવે નંબર-૧૨૨/૨ પૈકી એકર ૧-૨૪ ગુંઠાની ખેતીની જમીન શ્રી અરશીભાઈ જગમાલભાઈ પાસેથી અનુ.નં.૧૫૩૧, તા.૧૫/૩/૨૦૦૪ ના રજી. વેચાણ દસ્તાવેજથી શ્રી સુખદેવભાઈ ગોરધનભાઈ પટેલએ ખરીદ કરેલ. આ બાબતની નોંધ ગામ નુમના નંબર-૬, હકક પત્રકે નોંધ નંબર-૧૧૫૩૭ થી થયેલ છે.

/૫/ ત્યારબાદ સદરહુ રેવન્યુ સરવે નંબર-૧૨૨/૨ પૈકી એકર ૧-૨૪ ગુંઠાની ખેતીની જમીન તેના ઉપરોક્ત માલીકએ રહેણાંકના હેતુ માટે બીનખેતીમાં ફેરવવા માટે પ્લાન તથા અરજી તૈયાર કરી કલેક્ટર કચેરી, જુનાગઢને અરજ અહેવાલ કરતા કલેક્ટર કચેરી, જુનાગઢના હુકમ નંબર-લેન્ડ/૧/સી/એન.એ./૨જી.નં. ૨૨/૨૦૧૦-૨૦૧૧, તા. ૧૦/૨/૨૦૧૧ ના રોજથી બીનખેતીમાં ફેરવી આપેલ છે. અને તેનો લે-આઉટ પ્લાન પણ પાસ કરવામાં આવેલ. આ બાબતની નોંધ ગામ નમુના નંબર-૬ હકક પત્રકે નોંધ નંબર-૧૮૨૩૮ થી થયેલ છે. અને આ સમગ્ર બીનખેતી થયેલ જમીન "હરી ઓમ નગર-બી" ના નામે ઓળખાય છે.

/૬/ ત્યારબાદ ઉપરોક્ત રીતે બીનખેતી થયેલ જમીનમાં પાડવામાં આવેલ પ્લોટો પૈકી પ્લોટ નંબર-૧, ચો.મીટર ૧૫૫૪-૭૫ ના ચો.વાર ૧૮૫૯-૪૮ આ. ની ખુલ્લી જમીન તેના માલીક શ્રી સુખદેવભાઈ ગોરધનભાઈ પટેલ (સરનેમ-ઘાડીયા) ના કુલ મુખત્યાર શ્રી ઝવેરભાઈ અરજણભાઈ વઘાસીયા પાસેથી અનુ.નં. ૧૭૮૪, તા.૨૧/૨/૨૦૧૨ ના રજી. વેચાણ દસ્તાવેજથી (૧) શ્રી મુક્તાબેન નારણદાસ સાપરીયા, (૨) શ્રી બીપીનભાઈ મુળજીભાઈ જાવીયા, (૩) શ્રી દિવ્યાબેન બાબુલાલ ડેડકીયા, (૪) શ્રી રશિમબેન પ્રવિણભાઈ પટેલ તથા (૫) શ્રી સંજયભાઈ ગોરધનભાઈ જાકાસણીયા-એ ખરીદ કરેલ. આ બાબતની નોંધ ગામ નમુના નંબર-૬ હકક પત્રકે નોંધ નંબર-૨૧૧૫૦ થી થયેલ છે.

/૭/ આ ઉપરાંત ઉપરોક્ત રીતે બીનખેતી થયેલ જમીનમાં પાડવામાં આવેલ પ્લોટો પૈકી પ્લોટ નંબર-૨, ચો.મીટર ૧૦૮૮-૭૮ ના ચો.વાર ૧૩૦૨-૧૮ આ. ની ખુલ્લી જમીન તેના માલીક શ્રી સુખદેવભાઈ ગોરધનભાઈ પટેલ (સરનેમ-ઘાડીયા) ના કુલ મુખત્યાર શ્રી ઝવેરભાઈ અરજણભાઈ વઘાસીયા પાસેથી અનુ.નં. ૧૭૮૩, તા. ૨૧/૨/૨૦૧૨ ના રજી. વેચાણ દસ્તાવેજથી (૧) શ્રી મુક્તાબેન નારણદાસ સાપરીયા, (૨) શ્રી બીપીનભાઈ મુળજીભાઈ જાવીયા, (૩) શ્રી દિવ્યાબેન બાબુલાલ ડેડકીયા, (૪) શ્રી રશિમબેન પ્રવિણભાઈ પટેલ તથા (૫) શ્રી સંજયભાઈ ગોરધનભાઈ જાકાસણીયા-એ ખરીદ કરેલ. આ બાબતની નોંધ ગામ નમુના નં. ૬ હકક પત્રકે નોંધ નંબર-૨૧૧૫૨ થી થયેલ છે.

/૮/ ત્યારબાદ સદરહુ પ્લોટ નંબર-૧, ચો.મીટર ૧૫૫૪-૭૫ ના ચો.વાર ૧૮૫૯-૪૮ આ. તથા પ્લોટ નંબર-૨, ચો.મીટર ૧૦૮૮-૭૮ ના ચો.વાર ૧૩૦૨-૧૮ આ. મળી કુલ જમીન ચો.મીટર ૨૬૪૩-૫૩ આ. ક્ષેત્રફળ ધરાવતી ખુલ્લી જમીન બાંધકામ મંજૂરીના હકકો સાથે તેના માલીકો (૧) શ્રી મુક્તાબેન નારણદાસ સાપરીયા, (૨) શ્રી બીપીનભાઈ મુળજીભાઈ જાવીયા, (૩) શ્રી દિવ્યાબેન બાબુલાલ ડેડકીયા, (૪) શ્રી રશિમબેન પ્રવિણભાઈ પટેલ તથા (૫) શ્રી સંજયભાઈ ગોરધનભાઈ જાકાસણીયા પાસેથી અનુ.નં. ૩૦૬૭, તા.૪/૭/૨૦૨૦ ના રજી. વેચાણ દસ્તાવેજથી "શ્રીજી બિલ્ડીર્સ" - જુનાગઢ નામથી ચાલતી ભાગીદારી પેઢી વતી તેના ભાગીદારો શ્રી શૈલેષકુમાર કરશનભાઈ બુટાણી, શ્રી પુનીતકુમાર મગનભાઈ બુટાણી, શ્રી દિનેશભાઈ લીંબાભાઈ બફલીપરા, શ્રી કપીલભાઈ કેશવભાઈ અંકોલા, શ્રી જયંતીલાલ નાથાભાઈ કાવઠીયા, શ્રી સંજય ગોરધનભાઈ જાકાસણીયા, શ્રી દિવ્યાબેન બાબુલાલ ડેડકીયા, શ્રી રશિમ પ્રવિણ પટેલએ ખરીદ કરેલ છે. આ બાબતની નોંધ ગામ નમુના નંબર-૬ હકક પત્રકે નોંધ નંબર-૨૭૩૮૨ થી થયેલ છે.

/૯/ ઉપરોક્ત રીતે સદરહુ પ્લોટ નંબર-૧ તથા ૨ ની મળી કુલ જમીન ચો.મીટર ૨૬૪૩-૫૩ આ. ની જમીનમાં બહુમાળી બિલ્ડીંગો બાંધવા માટેનું આયોજન કરવામાં આવેલ, અને જે અંગેની બાંધકામ મંજૂરી મેળવવા માટે અરજી કરવામાં આવેલ તે અનુસંધાને જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી રજા ચીટી નંબર - JMC/29-02-2020/1397463/01/005505 થી બાંધકામ મંજૂરી આપવામાં માટેનો ઓર્ડર તા.૦૨/૦૩/૨૦૨૦ ના રોજથી કરવામાં આવેલ અને તેની રજાચીટી તા.૫-૭-૨૦૨૧ થી આપવામાં આવેલ છે. અને બાંધકામ પ્લાન પાસ થયેલ છે. આ પાસ થયેલ બાંધકામ પ્લાન મુજબ "શ્રીજી બિલ્ડર્સ" - જુનાગઢ ના નામે ચાલતી ભાગીદારી પેઢીએ સદરહુ પ્લાન નંબર-૧ તથા ૨ ની મળી કુલ જમીન ચો.મીટર ૨૬૪૩-૫૩ આ. ની જમીનમાં "સવન રેસીડેન્સી-એ", "સવન રેસીડેન્સી-બી", "સવન રેસીડેન્સી-સી" નામના બહુમાળી બિલ્ડીંગનું બાંધકામ કરેલ અને તેની તમામ પ્રકારની વ્યવસ્થા કરવાનો હકક અને અધિકાર છે.

અને જ્યારે પ્રયોજક પ્રોજેક્ટ જમીન ઉપર ઈમારતોનું બાંધકામ કરવા માટે અધિકાર ધરાવે છે.

અને જ્યારે પ્રોજેક્ટ જમીન પ્રયોજકના કબજામાં છે.

અને જ્યારે પ્રયોજકે પ્રોજેક્ટ જમીન ઉપર ૩(ત્રણ) ઈમારત રેસીડેન્સીયલ જે ત્રણેય ઈમારતમાં ગ્રાઉન્ડ ફ્લોર + ૭(સાત)માળનું બાંધકામ કરવાનું સુચિત કરેલ છે.

અને જ્યારે પ્રયોજક દ્વારા પ્રોજેક્ટના ૧ ફેઝમાં બાંધવામાં આવેલ " સવન રેસીડેન્સી-એ, " સવન રેસીડેન્સી-બી", સવન રેસીડેન્સી-સી" નામથી ઓળખાતી ઈમારતમાં (જેને હવે પછી સદર "ઈમારત" તરીકે સંબોધવામાં આવશે) માળ ઉપર (જેને હવે પછી સદર "એપાર્ટમેન્ટ" તરીકે સંબોધવામાં આવશે)..... નંબરનો એપાર્ટમેન્ટ ફાળવણીથી મેળવનારને આપવામાં આવેલ છે.

અને જ્યારે પ્રયોજકે રીયલ એસ્ટેટ નિયમનકારી સત્તાધિકારી, મુ.ગાંધીનગર પાસેથી નંબરથી અધિનિયમની જોગવાઈઓ હેઠળ પ્રોજેક્ટની નોંધણી કરાવેલ છે, જેની પ્રમાણિત નકલ આ સાથે એનેક્ષર 'બી' ઉપર સામેલ છે.

અને જ્યારે વિકાસ કરાર/કુલમુખત્યારનામાના આધારે પ્રયોજક પ્રોજેક્ટ જમીન ઉપર બાંધેલ સદર ઈમારતોમાં બનાવેલ એપાર્ટમેન્ટોનું વેચાણ કરવા તથા તે અંગે ફાળવણીથી મેળવનારાઓ પાસેથી સ્વીકારેલ વેચાણ અવેજની રકમો બાબતે કરારો કરવા એકમાત્ર અને પ્રત્યક્ષ અધિકાર ધરાવે છે.

અને જ્યારે ફાળવણીથી મેળવનારાની માંગણી ઉપર, પ્રયોજકે ફાળવણીથી મેળવનારાને પ્રોજેક્ટ જમીન સંબંધિત તમામ ટાઈટલના દસ્તાવેજો તથા પ્લાનો, નકશાઓ અને સ્પષ્ટીકરણ, જે પ્રયોજકના આર્કિટેક્સ ભાવેશ નરોત્તમદાસ પટેલ એ બનાવેલ છે. અને તેવા અન્ય દસ્તાવેજો જે રિયલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ)એક્ટ, ૨૦૧૬ (જેને હવે પછી 'સદર અધિનિયમ' તરીકે સંબોધવામાં આવશે) તેમજ તે હેઠળ ઘડેલ નિયમો હેઠળ નિદિષ્ટ કરેલ હોય તેવા તમામ દસ્તાવેજોની ચકાસણી કરવા આપેલ છે તેમજ તેનાથી ફાળવણીથી મેળવનારા સંતુષ્ટ થયેલ છે.

અને જ્યારે ફાળવણીથી મેળવનારાએ પ્રયોજકના કાયદાકીય મુખત્યારનામાના અથવા વકીલશ્રીએ આપેલ ટાઈટલ સર્ટીફિકેટની પ્રમાણિત નકલો, જે પ્રોજેક્ટ જમીન ઉપર એપાર્ટમેન્ટોનું બાંધકામ થયેલ છે અથવા થવાનું છે તે જમીનના ટાઈટલના પ્રકાર દર્શાવતો ગામ નમુના નં. ૬ અને ૭ અને ૧૨ અથવા અન્ય તમામ સંબંધિત મહેસુલી રેકર્ડ પણ તપાસી લીધેલ છે અને તેઓ તે સંદર્ભે સંતુષ્ટ થયેલ છે.

અને જ્યારે ફાળવણીથી મેળવનારાએ સંબંધિત સ્થાનિક સત્તામંડળે મંજૂર કરેલ લે-આઉટના પ્લાનોની પ્રમાણિત નકલોની ચકાસણી કરી લીધેલ છે.

અને જ્યારે ફાળવણીથી મેળવનારાએ પ્રયોજકે સુચિત કરેલ લે-આઉટના પ્લાનો અને જેના અનુસાર સદર પ્રોજેક્ટમાં ઈમારતો અને ખુલ્લી જગ્યાઓનું

બાંધકામ કરવાનું સૂચિત કરેલ છે તે તમામની પ્રમાણિત નકલોની ચકાસણી કરી લીધેલ છે.

અને જ્યારે ફાળવણીથી મેળવનારા વેચાણ રાખવા માટે સંમત થયેલ એપાર્ટમેન્ટના પ્લાનો અને સ્પષ્ટીકરણની પ્રમાણિત નકલો આ સાથે એનેક્સર 'એ' ઉપર સામેલ રાખેલ છે.

અને જ્યારે પ્રયોજકે સંબંધિત સ્થાનિક સત્તાધિકારી(ઓ) પાસેથી પ્લાનો, સ્પષ્ટીકરણો, એલીવેશનો, વિભાગો અને સદર ઈમારતો અંગેની અમુક મંજૂરીઓ મેળવી લીધેલ છે અને બાકી રહેતી મંજૂરીઓ તેઓએ, સદર ઈમારતનું ઈમારત પુર્ણતા પ્રમાણપત્ર અથવા કબજા પ્રમાણપત્ર મેળવવા માટે વખતોવખત વિવિધ સત્તાધિકારીઓ પાસેથી મેળવવાની રહેશે.

અને જ્યારે સદર પ્લાનો મંજૂર કરતી વખતે સંબંધિત સ્થાનિક સત્તામંડળ અને/અથવા સરકારે આવતી અમુક શરતો, સમજૂતીઓ, ધારાધોરણો, મર્યાદાઓ અને પ્રતિબંધો મુકેલ છે જે પ્રયોજકે પ્રોજેક્ટ જમીનના તથા સદર ઈમારતના વિકાસમાં પાલન કરવાનું છે અને તેનું યોગ્ય પાલન અને આધીનતાના આધારે જ સદર ઈમારતોના સંદર્ભમાં સંબંધિત સ્થાનિક સત્તામંડળે તેઓને પુર્ણતા પ્રમાણપત્ર અથવા કબજા પ્રમાણપત્ર આપવાનું રહેશે.

અને જ્યારે પ્રયોજકે તદનુસાર સદર સુચિત પ્લાનોનું અનુસરણ કરીને સદર ઈમારતોનું બાંધકામ શરૂ કરેલ છે.

અને જ્યારે ફાળવણીથી મેળવનારાઓ સદર પ્રોજેક્ટના ફેઝમાં બાંધેલ ઈમારત નંબર ના વિભાગમાં આવેલ માળ ઉપરના એપાર્ટમેન્ટ નંબર ની ફાળવણી માટે પ્રયોજકને અરજી કરેલ છે.

અને જ્યારે સદર એપાર્ટમેન્ટનો કાર્પેટ એરીયા ચો.મી. / ચો.ફુટ છે અને "કાર્પેટ એરીયા" એટલે કે એક એપાર્ટમેન્ટનો ચોખ્ખો વપરાશ લાયક જમીન તળનો વિસ્તાર, જેમાં બાહ્ય દિવાલોનો ક્ષેત્ર, સર્વિસ શાફ્ટ હેઠળનો ક્ષેત્ર, બાહ્ય બાલ્કની અથવા વરંડા અને બાહ્ય ખુલ્લી અગાશીનો ક્ષેત્રનો સમાવેશ થતો નથી, પરંતુ એપાર્ટમેન્ટના આંતરિક વિભાજનમાં વપરાયેલ ક્ષેત્રનો સમાવેશ થાય છે.

અને જ્યારે બંને પક્ષકારો, આ કરારમાં દર્શાવેલ તમામ શરતો, સમજૂતીઓ અને મર્યાદાઓનું પાલન કરવાની તેમજ તમામ લાગુ પડતા કાયદાઓનું પાલન કરવાની એકબીજાની સંમતિઓ, રજૂઆતો અને ખાતરીઓ ઉપર વિશ્વાસ કરીને, હવે નીચે મુજબની શરતો અને સમજૂતીઓને આધીન આ કરાર કરવા રાજી થયેલ છે.

અને જ્યારે આ કરાર કર્યા પહેલા ફાળવણીથી મેળવનારાએ પ્રયોજકને, પ્રયોજકે ફાળવણીથી મેળવનારાને વેચાણ આપવા નક્કી થયેલ એપાર્ટમેન્ટના વેચાણ અવેજની આંશિક ચુકવણી પેટે, એડવાન્સ પેમેન્ટ અથવા અરજીની ફી તરીકે (જેની ચુકવણી અને સ્વીકૃતિ બંને પ્રયોજક આથી સ્વીકારે છે અને પહોંચ આપે છે) રૂા. (અંકે રૂપિયા)

પુરાની રકમ ચુકવેલ છે. અને ફાળવણીથી મેળવનારા નીચે દર્શાવ્યા મુજબ બાકી રહેલ વેચાણ અવેજની રકમ પ્રયોજકને ચુકવી આપવા સંમત થાય છે.

અને જ્યારે સદર અધિનિયમની કલમ-૧૩ હેઠળ પ્રયોજકે ફાળવણીથી મેળવનારા સાથે સદર એપાર્ટમેન્ટ સંદર્ભે એક લેખિત વેચાણ કરાર કરવાનો રહેશે, જે હકીકતમાં આ જ કરાર છે અને સદર કરારની નોંધણી રજિસ્ટ્રેશન એક્ટ, ૧૯૦૮ હેઠળ કરાવવાની રહેશે.

આ કરારમાં દર્શાવેલ તેમજ પક્ષકારો દ્વારા અને વચ્ચે સંમતિથી નક્કી કરવામાં આવેલ શરતો અને સમજૂતીઓ અનુસાર, સદર (એપાર્ટમેન્ટ/પ્લોટ) તથા ગેરેજ/બંધ પાર્કિંગ (જો હોય તો) પ્રયોજક આથી વેચાણ આપવા અને ફાળવણીથી મેળવનારા આથી ખરીદ કરવા સંમત થાય છે.

હવે તેથી આ કરાર નીચે મુજબ બંને પક્ષકારો દ્વારા અને વચ્ચે કરવામાં આવે છે જે નીચે મુજબ છે.

૧. પ્રવતકે સંબંધિત સ્થાનિક સત્તામંડળ પાસેથી વખતોવખત મંજૂર થયેલ પ્લાનો, નકશાઓ અને સ્પષ્ટીકરણ અનુસાર ઈમારતો જેમાં ૩(ત્રણ) ઈમારત રેસીડેન્શીયલ જે ઈમારતમાં શુન્ય ભોંયરૂ, એક ગ્રાઉન્ડ/સ્ટીલ્ટ/ શુન્ય પોડિયમો અને ૭ ઉપરના માળાઓ હોય તેનું પ્રોજેક્ટ જમીન ઉપર બાંધકામ કરવાનું રહેશે.

એ શરતે કે પ્રયોજકે ફાળવણીથી મેળવનારાના એપાર્ટમેન્ટને ગંભીર રીતે અસર કરતું હોય તેવા સુધારો અને ફેરફારો કરવા પહેલાં ફાળવણીથી મેળવનારાની લેખિત સંમતિ લેવાની રહેશે, સિવાય કે કોઈ સહકારી સત્તાધિકારીઓ અથવા કાયદામાં થયેલ ફેરફારના કારણે કોઈ સુધારા અને ફેરફારની આવશ્યકતા ઉભી થયેલ હોય.

૧(એ)

/૧/ ઈમારત/વિભાગના માળ ઉપર આવેલ એપાર્ટમેન્ટ નંબર પ્રકાર જેનું કાર્પેટ એરીયા ક્ષેત્રફળ ચો.મી./ચો.ફુટ છે(જેને હવે પછી 'સદર એપાર્ટમેન્ટ' તરીકે સંબોધવામાં આવશે) તે એપાર્ટમેન્ટને રૂા. રૂપિયા ના વેચાણ અવેજમાં, જે વેચાણ અવેજની રકમ મજિયારા વિસ્તારો અને એપાર્ટમેન્ટને લગતી સુવિધાઓના પ્રમાણસરની રકમ છે, જે મજિયારા વિસ્તારો અને

સુવિધાઓની પ્રકૃતિ, હદ અને વર્ણન આ સાથેના બીજા પરિશિષ્ટમાં વધુ વિગતવાર દર્શાવવામાં આવેલ છે. પ્રયોજકે ફાળવણીથી મેળવનારાને આથી વેચાણ આપવા તેમજ ફાળવણીથી મેળવનારા પ્રયોજક પાસેથી આથી ખરીદ કરવા સંમત થયેલ છે. (મંજિયારા વિસ્તારો અને સુવિધાઓ તેમજ પાર્કિંગની જગ્યાની પ્રમાણસરની રકમ સહિતની એપાર્ટમેન્ટની કિંમત અલગથી દર્શાવવી.)

/૨/ બાલ્કની/વરંડા ૧ જેનું ક્ષેત્રફળ ચો.મી./ચો.ફુટ છે જે એપાર્ટમેન્ટનો એક ભાગ બને છે તેને વેચાણ અવેજની રકમ રૂ. માં પ્રયોજકે ફાળવણીથી મેળવનારાને આથી વેચાણ આપવા તેમજ ફાળવણીથી મેળવનારા પ્રયોજક પાસેથી આથી ખરીદ કરવા સંમત થયેલ છે.

/૩/ બાલ્કની/વરંડા ૨ જેનું ક્ષેત્રફળ ચો.મી./ચો.ફુટ છે જે એપાર્ટમેન્ટનો એક ભાગ બને છે તેને વેચાણ અવેજની રકમ રૂ. માં પ્રયોજકે ફાળવણીથી મેળવનારાને આથી વેચાણ આપવા તેમજ ફાળવણીથી મેળવનારા પ્રયોજક પાસેથી આથી ખરીદ કરવા સંમત થયેલ છે.

/૪/ વોશ એરિયા બાલ્કની જેનું ક્ષેત્રફળ ચો.મી./ચો.ફુટ છે જે એપાર્ટમેન્ટનો એક ભાગ બને છે તેને વેચાણ અવેજની રકમ રૂ. માં પ્રયોજકે ફાળવણીથી મેળવનારાને આથી વેચાણ આપવા તેમજ ફાળવણીથી મેળવનારા પ્રયોજક પાસેથી આથી ખરીદ કરવા સંમત થયેલ છે.

/૫/ ખુલ્લી અગાશી જેનું ક્ષેત્રફળ ચો.મી./ચો.ફુટ છે જે એપાર્ટમેન્ટનો એક ભાગ બને છે તેને વેચાણ અવેજની રકમ રૂ. માં પ્રયોજકે ફાળવણીથી મેળવનારાને આથી વેચાણ આપવા તેમજ ફાળવણીથી મેળવનારા પ્રયોજક પાસેથી આથી ખરીદ કરવા સંમત થયેલ છે.

/૬/ લે-આઉટમાં બાંધવામાં આવેલ ભોંયરા અને / અથવા સ્ટીલ્ટ અને / અથવા પોડિયમમાં આવેલ ખુલ્લી પાર્કિંગની જગ્યા નંબર અવેજની રકમ રૂ. માં પ્રયોજકે ફાળવણીથી મેળવનારાને આથી વેચાણ આપવા તેમજ ફાળવણીથી મેળવનારા પ્રયોજક પાસેથી આથી ખરીદ કરવા સંમત થયેલ છે.

/૭/ લે—આઉટમાં બાંધવામાં આવેલ ભોંયરા અને / અથવા સ્ટીલ્ટ અને / અથવા પોડિયમમાં આવેલ બંધ(છતવાળા) પાર્કિંગની જગ્યા નંબર અવેજની રકમ રૂા. માં પ્રયોજકે ફાળવણીથી મેળવનારાને આથી વેચાણ આપવા તેમજ ફાળવણીથી મેળવનારા પ્રયોજક પાસેથી આથી ખરદ કરવા સંમત થયેલ છે.

૧ (બી) ઉપરોક્ત કલોઝ(૧) થી (૭)માં જણાવેલ એપાર્ટમેન્ટની કુલ એકંદરે વેચાણ અવેજની રકમ રૂા. છે.

૧ (સી) ફાળવણીથી મેળવનારાએ આ કરાર કયા સમયે અથવા તે પહેલાં એડવાન્સ ચુકવણી અથવા અરજીની ફી તરીકે રૂા. (રૂપિયા) (કુલ વેચાણ અવેજની રકમના ૧૦% કરતાં વધુ ન હોવી જોઈએ)જેટલી રકમ ચુકવેલી છે અને તેઓ પ્રયોજકને બાકી રહેલી રકમ રૂા. (રૂપિયા)દસ્તાવેજ કરતી વખતે

અથવા

નીચેની વિગતે ચુકવી આપવા આથી સંમત થયેલ છે.

/૧/ કરાર કર્યા બાદ પ્રયોજકને રૂા. (રૂપિયા) (કુલ વેચાણ અવેજની રકમના ૩૦% કરતાં વધુ ન હોવી જોઈએ)ની રકમ ચુકવવી.

/૨/ જે ઈમારત અથવા વિભાગમાં એપાર્ટમેન્ટ આવેલ હોય તેનું પ્લીન્થનું બાંધકામ પુણ થયા બાદ પ્રયોજકને રૂા. (રૂપિયા) (કુલ વેચાણ અવેજની રકમના ૪૫% કરતાં વધુ ન હોવી જોઈએ)ની રકમ ચુકવવી.

/૩/ જે ઈમારત અથવા વિભાગમાં એપાર્ટમેન્ટ આવેલ હોય તેનું પોડિયમ અને સ્ટીલ્ટ સહીતનું બાંધકામ પુણ થયા બાદ પ્રયોજકને રૂા. (રૂપિયા) (કુલ વેચાણ અવેજની રકમના ૭૦% કરતાં વધુ ન હોવી જોઈએ)ની રકમ ચુકવવી.

/૪/ સદર એપાર્ટમેન્ટની દિવાલો, આંતરિક પ્લાસ્ટર, ફ્લોરિંગ, દરવાજા અને બારીઓનું કામ પુણ થયા બાદ પ્રયોજકને રૂા.

(રૂપિયા) (કુલ વેચાણ અવેજની રકમના ૭૫% કરતાં વધુ ન હોવી જોઈએ)ની રકમ ચુકવવી.

/૫/ સદર એપાર્ટમેન્ટના સેનિટરી(બાથરૂમ) ફીટીંગ, સીડી, લીફ્ટ વેલ, લોબીઓનું કામપુર્ણ થયા બાદ પ્રયોજકને રૂા. (રૂપિયા) (કુલ વેચાણ અવેજની રકમના ૮૦% કરતાં વધુ ન હોવી જોઈએ)ની રકમ ચુકવવી.

/૬/ જે ઈમારત અથવા વિભાગમાં એપાર્ટમેન્ટ આવેલ હોય તેનું બાહ્ય પ્લમ્બિંગ (પાણીની પાઈપોને લગતું કામ) અને બાહ્ય પ્લાસ્ટર, એલિવેશન, અગાશીઓનું કામ વોટરપ્રુફિંગ સાથે પુણ થયા બાદ પ્રયોજકને રૂા. (રૂપિયા) (કુલ વેચાણ અવેજની રકમના ૮૫% કરતાં વધુ ન હોવી જોઈએ)ની રકમ ચુકવવી.

/૭/ જે ઈમારત અથવા વિભાગમાં એપાર્ટમેન્ટ આવેલ હોય તેના લીફ્ટ, વોટરપંપ, ઈલેક્ટ્રીક ફીટીંગ, ઈલેક્ટ્રો-મિકેનિકલ અને પયા વરણીય આવશ્યકતાઓ, પ્રવેશ લોબીઓ, પ્લીનથ સુરક્ષા, સંબંધિત ક્ષેત્રોનું ફરસ(પેવિંગ) તેજમ નિયત કયા મુજબની અન્ય તમામ આવશ્યકતાઓ પુર્ણ થયા બાદ પ્રયોજકને રૂા. (રૂપિયા) (કુલ વેચાણ અવેજની રકમના ૯૫% કરતાં વધુ ન હોવી જોઈએ)ની રકમ ચુકવવી.

/૮/ કબજા પ્રમાણપત્ર અથવા પુર્ણતા પ્રમાણપત્ર મેળવી લીધા બાદ અથવા તે સમયે એપાર્ટમેન્ટનો કબજો ફાળવણીથી મેળવનારાને સુપ્રત કરતી વખતે બાકી રહેતી રકમ રૂા. (રૂા.) ચુકવવી.

૧ (ડી) ઉપરોક્ત જણાવેલ કુલ કિંમતમાં એપાર્ટમેન્ટ/પ્લોટનો કબજો સુપ્રત કર્યાની તારીખ સુધીના ટેક્ષ(કરવેરા)(જેમાં પ્રયોજક દ્વારા ચુકવવા પાત્ર થતો ટેક્ષ જેમ કે જી.એસ.ટી., વેલ્યુ એડેડ ટેક્ષ, સર્વિસ ટેક્ષ અને ઉપકર અથવા તેવા અન્ય વેરાઓ જે પ્રયોજકે પ્રોજેક્ટના બાંધકામ કરવાના સંદર્ભમાં ચુકવવા પાત્ર થતો હોય)નો સમાવેશ થતો નથી જે પ્રયોજક નક્કી કરે તે પ્રમાણે ફાળવણીથી મેળવનારાએ અલગથી ચુકવવાનો રહેશે.

૧(ઈ) કુલ કિંમત વધારા રહિત છે, સિવાય કે સંબંધિત સક્ષમ સત્તાધિકારીને ચુકવવા પાત્ર થતા વિકાસ ખર્ચના કારણે અને અથવા/ સક્ષમ સત્તાધિકારી, સ્થાનિક બોડી/સરકાર દ્વારા વખતોવખત લેવામાં આવેલ અથવા લાદવામાં આવેલ ખર્ચમાં થયેલ વૃદ્ધિના કારણે, પ્રયોજક સંમત થાય છે તેમજ ખાતરી આપે છે કે ફાળવણીથી મેળવનારા પાસે સક્ષમ સત્તાધિકારી, વિગેરેનાઓ દ્વારા લાદવામાં આવેલ વિકાસ ચાર્જ, ખર્ચ અથવા કરમાં થયેલ વધારાની માંગણી કરવામાં આવે ત્યારે પ્રયોજકે ફાળવણીથી મેળવનારાને આપેલ માંગણી પત્ર સાથે તે અંગે પ્રસિધ્ધ થયેલ જાહેરનામા/ હુકમ/નિયમ/નિયમન બિડવાના રહેશે જે ત્યાર પછીની ચુકવણી ઉપર જ લાગુ પડશે.

૧(એફ) પ્રયોજક, તેઓના સ્વતંત્ર વિનિયમથી, ફાળવણીથી મેળવનારા દ્વારા ચુકવવા પાત્ર થતાં સરખા હપ્તાની વહેલી ચુકવણી માટે તેવી વહેલી ચુકવણીમાં જે તે હપ્તાને જેટલી મુદત માટે વહેલા ચુકવવામાં આવેલ હોય તેના ૩% પ્રતિવર્ષની છુટ આપીને રિબેટ આપી શકશે અને તેવા રિબેટનો દર, એક વાર પ્રયોજક દ્વારા ફાળવણીથી મેળવનારાને આપ્યા બાદ ફેરતપાસ/ઉપાડને આધીન રહેશે નહીં.

૧(જી) પ્રયોજકે ફાળવણીથી મેળવનારાને, ઈમારતના બાંધકામનું કામ પુર્ણ થયા બાદ અને સક્ષમ સત્તાધિકારી પાસેથી કબજા પ્રમાણપત્ર મેળવ્યા બાદ, ૩ ટકાના ફેરફારના ગાળાને આધીન, કાર્પેટ એરિયામાં કરેલ ફેરફારો, જો હોય તો, તેની વિગતો દર્શાવીને, ફાળવણી થયેલ છેવટના કાર્પેટ એરિયાની ખાતરી કરવાની રહેશે. પ્રયોજક દ્વારા ખાતરી થયા બાદ કાર્પેટ એરિયા માટે ચુકવેલ કુલ અવેજની રકમની ફરી ગણતરી કરવાની રહેશે. જો નિયત મર્યાદામાં કાર્પેટ એરિયામાં કોઈ ઘટાડો થયેલ હોય તો, પ્રયોજકે ફાળવણીથી મેળવનારાએ ચુકવેલ વધારાની રકમ, જ્યારથી તેવી વધારાની રકમ ફાળવણીથી મેળવનારાએ તે તારીખ ૯% ના વાર્ષિક વ્યાજ સાથે પિસ્તાલીસ દિવસમાં ચુકવી આપવાની રહેશે. ફાળવણીથી મેળવનારાને ફાળવવામાં આવેલ કાર્પેટ એરિયામાં કોઈ વધારો થયેલ હોય તો, પ્રયોજકે ફાળવણીથી મેળવનારા પાસે ચુકવણીના પ્લાનના બીજા માર્ઈલસ્ટોન મુજબ વધારાની રકમની માંગણી કરવાની રહેશે. આ તમામ નાણાંકીય વ્યવસ્થાઓ કરારના કલોઝ-૧(એ)માં સંમત થયા મુજબ પ્રતિ ચો.મી. ના સરખા ભાવે જ કરવાના રહેશે.

૧ (એચ) ફાળવણીથી મેળવનારા આથી પ્રયોજકને તેઓ સામે રહેલા કોઈપણ બાકી લેણાં, જો હોય તો, હેઠળ તેઓ દ્વારા કરવામાં આવેલ કોઈપણ ચુકવણીની વ્યવસ્થા તેઓના નામે પ્રયોજકને સ્વતંત્ર રીતે યોગ્ય જણાય તે રીતે કરવા અધિકૃત કરે છે તેમજ ફાળવણીથી મેળવનારા કોઈપણ પ્રકારે તેઓ દ્વારા કરવામાં આવેલ ચુકવણી અંગે પ્રયોજક સામે વાંધો/માંગણી/ નિર્દેશ ન કરવા બાંહેધરી આપે છે.

નોંધ :-

પેટા કલોઝ—(૨) અને (૩) માં નિર્દિષ્ટ કરેલ દરેક હપ્તાઓને, બહુમાળી ઈમારત/વિભાગના કિસ્સામાં ભૌંયરાઓ/પોડિયમો/માળાઓની સંખ્યા સાથે જોડાયેલ વિવિધ હપ્તાઓમાં પુનઃવિભાજિત કરવાના રહેશે.

૨.૧ સદર પ્લાનો મંજૂર કરતી વખતે સંબંધિત સ્થાનિક સત્તામંડળ દ્વારા લાદવામાં આવેલ શરતો, સમજૂતીઓ, સમયમર્યાદાઓ અને પ્રતિબંધો, જો હોય તો, તેનું પાલન કરવા, નિભાવવા અને અનુસરણ કરવા પ્રયોજક આથી સંમત થાય છે તેમજ પ્રયોજકે ફાળવણીથી મેળવનારાને કબજો સુપ્રત કર્યા પહેલાં સંબંધિત સ્થાનિક સત્તામંડળ પાસેથી સદર એપાર્ટમેન્ટના સંદર્ભમાં કબજા અને/અથવા પુર્ણતા પ્રમાણપત્રો મેળવી લેવાના રહેશે.

૨.૨ પ્રયોજક તેમજ ફાળવણીથી મેળવનારા માટે સમયસાર(એસેન્સ) છે. પ્રયોજકે પ્રોજેક્ટને પુર્ણ કરવાની તેમજ કબજા પ્રમાણપત્ર અથવા પુર્ણતા પ્રમાણપત્ર અથવા બંને, જે લાગુ પડતું હોય તે, મેળવી લીધા બાદ ફાળવણીથી મેળવનારાને એપાર્ટમેન્ટ/પ્લોટનો કબજો સુપ્રત કરવાની તેમજ ફાળવણીથી મેળવનારાના સંઘને મઝિયારા વિસ્તારો સુપ્રત કરવાની નિર્ધારિત સમયમર્યાદાનું પાલન કરવાનું રહેશે.

તેવી જ રીતે ફાળવણીથી મેળવનારાએ કરાર હેઠળ, પ્રયોજકે ઉપરોક્ત કલોઝ—૧ (સી)માં જણાવ્યા મુજબનું એક પછી એક બાંધકામનું કામ પુર્ણ કરેલ હોય તેને આધીન, હપ્તાઓ તથા અન્ય દેવાઓની ચુકવણી સમયસર કરવાની રહેશે તેમજ અન્ય જવાબદારીઓ અદા કરવાની રહેશે.

૩. પ્રયોજક આથી જાહેર કરે છે કે પ્રોજેક્ટ જમીનના સંદર્ભમાં આજ તારીખ સુધી ઉપલબ્ધ ફ્લોર સ્પેસ ઈન્ડેક્સ ૪૭૫૮.૩૫ ચો.મી. નું છે અને પ્રયોજકે પ્રિમિયમની ચુકવણીથી મળતું ટી.ડી.આ. અથવા એફ.એસ.આઈ. મેળવીને અથવા વિકાસ નિયંત્રણ નિયમોમાં નિર્દિષ્ટ વિવિધ યોજનાઓને

અમલમાં લાવીને ઈન્સેન્ટીવ એફ.એસ.આઈ. તરીકે ઉપલબ્ધ એફ.એસ.આઈ. મેળવીને અથવા ભવિષ્યમાં વિકાસ નિયંત્રણ નિયમો, જે સદર પ્રોજેક્ટને લાગુ પડતા હોય તેમાં થયેલ ફેરફારોથી ઉપલબ્ધ એફ.એસ.આઈ. મેળવીને ૭૧૩૭.૫૩ નો ફ્લોર સ્પેસ ઈન્ડેક્સ ઉપયોગમાં લેવાની યોજના ઘડેલ છે. પ્રયોજકે તેઓ દ્વારા પ્રોજેક્ટ જમીન ઉપર સદર પ્રોજેક્ટમાં ઉપયોગમાં લેવામાં આવતી ૭૧૨૨.૮૭ ની સુચિત ફ્લોર સ્પેસ ઈન્ડેક્સ જાહેર કરેલ છે અને ફાળવણીથી મેળવનારાએ, પ્રયોજક દ્વારા સુચિત એફ.એસ.આઈ.નો ઉપયોગ કરીને સુચિત બાંધકામ અને એપાર્ટમેન્ટોનું વેચાણ કરવામાં આવશે તેના આધારે અને જાહેર કરેલ સુચિત એફ.એસ.આઈ. પ્રયોજકની જ રહેશે તેવી સમજણથી સદર એપાર્ટમેન્ટ ખરીદ કરવા સંમત થયેલ છે.

૪.૧ જો પ્રયોજક બાંહેધરી આપેલ સમયમર્યાદામાં પ્રોજેક્ટ પુર્ણ કરવામાં અને ફાળવણીથી મેળવનારાને એપાર્ટમેન્ટ/પ્લોટની સોંપણી કરવામાં નિષ્ફળ જાય તો, પ્રયોજક ફાળવણીથી મેળવનારા, જે પ્રોજેક્ટમાંથી નીકળવા માંગતા ન હોય, ને ફાળવણીથી મેળવનારાઓએ ચુકવેલ દરેક રકમ ઉપર, દર વિલંબિત મહિના માટે, કબજો સુપ્ર કર્યાની તારીખ સુધી ૯% નું વાર્ષિક વ્યાજ ચુકવવા સંમત થાય છે. ફાળવણીથી મેળવનારા, ફાળવણીથી મેળવનારા દ્વારા પ્રયોજકને ચુકવવા પાત્ર થતી રકમ ચુકવવામાં કરેલ વિલંબ અંગે તેવી રકમ ફાળવણીથી મેળવનારાએ પ્રયોજકને ચુકવણી કરવાની થતી હોય તેવી તારીખથી ૯% વાર્ષિક વ્યાજના દરે ચુકવી આપવા સંમત થયેલ છે.

૪.૨ પ્રયોજકના, ઉપરોક્ત પેટા કલોઝ-૪.૧ અનુસાર ફાળવણીથી મેળવનારા ઉપર તેઓ દ્વારા આ કરાર હેઠળ પ્રયોજકને ચુકવવા પાત્ર થતી રકમ (જેમાં તેઓનો પ્રમાણસરનો હિસ્સો અથવા સંબંધિત સત્તાધિકારી દ્વારા લાદવામાં આવેલ કર તેમજ અન્ય ખર્ચનો સમાવેશ થાય છે.)ની તેની તારીખે ચુકવણી કરવામાં કસુર કર્યેથી તેના ઉપર વ્યાજ લાદવાના તેઓના અધિકારને પુર્વગ્રહ ન થાય તે રીતે તેમજ ફાળવણીથી મેળવનારાએ ત્રણ હપ્તાઓની ચુકવણી કરવામાં કસુર કર્યેથી, પ્રયોજક તેઓની મરજી મુજબ આ કરારનો તે અંત લાવી શકશે.

એવી જોગવાઈ કરવામાં આવી છે કે, પ્રયોજકે તેઓની કરારનો અંત આણવાની ઈચ્છા વ્યક્ત કરતી જાણ તેમજ ફાળવણીથી મેળવનારાએ શરતોનો ભંગ અથવા એકથી વધુ ભંગ કરેલ હોય જેના કારણે તેઓ કરારનો અંત આણવા માંગતા હોય તે અંગેની જાણ ફાળવણીથી મેળવનારાને તેઓ દ્વારા આપવામાં આવેલ સરનામે રજિ.પોસ્ટ એ.ડી.થી

લેખિતમાં તથા તેઓ દ્વારા આપવામાં આવેલ ઈ-મેઈલ એડ્રેસ ઉપર ઈ-મેલ દ્વારા પંદર દિવસની નોટિસ આપવાની રહેશે. જો ફાળવણીથી મેળવનારા પ્રયોજકે દર્શાવેલ તેવો ભંગ અથવા એકથી વધુ ભંગને નોટિસની મુદતમાં સુધારવામાં નિષ્ફળ જાય તો તેવી નોટિસની સમયમર્યાદા પુરી થયેથી, પ્રયોજક આ કરારનો અંત લાવવા માટે હકકદાર રહેશે.

વધુમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે, ઉપરોક્ત જણાવ્યા મુજબ આ કરારનો અંત થયેથી, ફાળવણીથી મેળવનારાને કરારના અંત આવ્યાના ૩૦-દિવસની મુદતમાં, ફાળવણીથી મેળવનારાએ જે તે તારીખ સુધી પ્રયોજકને ચુકવેલ એપાર્ટમેન્ટના વેચાણ અવેજના હપ્તાઓ(કોઈ સ્વીકૃત નિર્ધારિત નુકસાનીઓની વ્યવસ્થા અને પરત ચુકવણી અથવા અન્ય કોઈ રકમ જે પ્રયોજકને ચુકવવા પાત્ર થતી હોય તેને આધીન) પરત ચુકવી આપવાની રહેશે.

૫. ફ્લોરીંગ અને સેનીટરીના ફીટીંગ સંબંધીત ફીટીંગો તથા સુવિધાઓ જેવી બ્રાન્ડ સાથેની એક અથવા વધુ લીફ્ટ, અથવા કિંમત વર્ગ જે પ્રયોજક તેઓની ઈચ્છા મુજબ સદર ઈમારત અને એપાર્ટમેન્ટમાં મુકવાની હોય તે આ સાથેના એનેક્સર 'સી' માં દર્શાવેલ છે.

૬. પ્રયોજકે ફાળવણીથી મેળવનારાને એપાર્ટમેન્ટનો કબજો તારીખ ૩૧/૧૨/૨૦૨૪ ના રોજ સુધીમાં સોંપી દેવાનો રહેશે. જો પ્રયોજક નિયત તારીખ સુધીમાં તેઓના અથવા તેમના એજન્ટોના નિયંત્રણ બહારના સંજોગોના કારણે ફાળવણીથી મેળવનારાને એપાર્ટમેન્ટનો કબજો સુપ્રત કરવામાં નિષ્ફળ જાય અથવા ઈન્કાર કરે તો પ્રયોજક, ફાળવણીથી મેળવનારાની માંગણી ઉપર એપાર્ટમેન્ટ સંદર્ભે તેઓએ સ્વીકારેલ રકમો જે તારીખથી પ્રયોજકે રકમ સ્વીકારેલ હોય ત્યારથી તે રકમો અને વ્યાજ ચુકવી આપવામાં આવે તે તારીખ સુધી કલોઝ ૪.૧ માં દર્શાવ્યા મુજબના દરના વ્યાજ સાથે ચુકવી આપવા બંધાયેલા છે.

એવી જોગવાઈ કરવામાં આવી છે કે, પ્રયોજકને એપાર્ટમેન્ટનો કબજો સુપ્રત કરવા માટે ઉપરોક્ત તારીખમાં વ્યાજબી છુટ(વિસ્તૃતિ) આપવાની રહેશે, જો એપાર્ટમેન્ટવાળી ઈમારતની પુર્ણતામાં નીચે મુજબના કારણોસર વિલંબ થયેલ હોય તો –

/૧/ યુદ્ધ, પ્રજા ક્ષોભ અથવા કુદરતી આપત્તિ

/૨/ સરકાર અને/અથવા જાહેર અથવા સક્ષમ સત્તાધિકારી/ અદાલતની કોઈ નોટિસ, હુકમ, નિયમ, જાહેરનામા

૭.૧ કબજો મેળવવાની પ્રક્રિયા :—

પ્રયોજકે સક્ષમ સતામંડળ પાસેથી કબજા પ્રમાણપત્ર મેળવ્યા બાદ તેમજ કરાર મુજબ ફાળવણીથી મેળવનારાએ રકમની ચુકવણી કર્યેથી એપાર્ટમેન્ટ/પ્લોટનો કબજો લેખિતમાં ફાળવણીથી મેળવનારાને આ કરાર અનુસાર તેવી નોટિસ પ્રસિદ્ધ થયાની તારીખથી ૩(ત્રણ) મહિનાની અંદર પ્રવર્તકે ફાળવણીથી મેળવનારાને એપાર્ટમેન્ટ/પ્લોટનો કબજો સોંપવાનો રહેશે. પ્રયોજક તેઓના ભાગની કોઈપણ જોગવાઈઓ, ઔપચારિકતાઓ, લખાણ કરવા/કરાવવામાં નિષ્ફળ જાય તો તેઓએ ફાળવણીથી મેળવનારાને તે બદલની નુકસાની આપવા માટે તેઓ સંમત થાય છે અને બાંહેધરી આપે છે. ફાળવણીથી મેળવનારા આથી પ્રયોજક અથવા ફાળવણીથી મેળવનારાઓના સંઘ, જે લાગુ પડતું હોય તે, દ્વારા નકકી કરવામાં આવેલ મેઈન્ટેનન્સના ખર્ચ આપવા સંમત થાય છે. પ્રયોજકે તેઓ વતી, પ્રોજક્ટના કબજા પ્રમાણપત્ર પ્રાપ્ત થયાના ૭-દિવસની અંદર ફાળવણીથી મેળવનારાને કબજો સોંપવાનો રહેશે.

૭.૨ પ્રયોજકે સદર એપાર્ટમેન્ટ વપરાશ માટે કબજા માટે તૈયાર છે તે અંગેની જાણ કરતી નોટીસ ફાળવણીથી મેળવનારાને પાઠવેલ હોય તેના પંદર દિવસની અંદર ફાળવણીથી મેળવનારે એપાર્ટમેન્ટનો કબજો સ્વીકારી લેવાનો રહેશે.

૭.૩ એપાર્ટમેન્ટ/પ્લોટનો કબજો સ્વીકારવા અંગે ફાળવણીથી મેળવનારની નિષ્ફળતા :

કલોઝ-૭.૧ મુજબ પ્રયોજક તરફથી લેખિત જાણ મળ્યેથી, ફાળવણીથી મેળવનારે પ્રયોજક પાસેથી જરૂરી ઈન્ડેમ્નીટીઓ, બાંહેધરીઓ તેમજ આ કરારમાં નિયત કરેલ અન્ય લખાણો અને દસ્તાવેજો કરાવી લઈ એપાર્ટમેન્ટ/પ્લોટનો કબજો સ્વીકારી લેવાનો રહેશે, અને પ્રયોજકે ફાળવણીથી મેળવનારાને એપાર્ટમેન્ટ/પ્લોટનો કબજો સોંપી દેવાનો રહેશે. કલોઝ-૭.૧ માં નિર્દિષ્ટ સમયમર્યાદામાં કબજો સ્વીકારવામાં ફાળવણીથી મેળવનારા નિષ્ફળ જાય તો તેવા ફાળવણીથી મેળવનાર લાગુ પડતા મેઈન્ટેનન્સ ખર્ચ ચુકવવા જવાબદાર રહેશે.

૭.૪ ફાળવણીથી મેળવનારાને એપાર્ટમેન્ટનો કબજો સુપ્રત કર્યાની તારીખથી પાંચ વર્ષની અંદર જો ફાળવણીથી મેળવનારા એપાર્ટમેન્ટ અથવા જે ઈમારતમાં એપાર્ટમેન્ટ સ્થિત હોય તેમાં રહેલ કોઈ માળખાકીય ખામી અથવા કારીગરલક્ષી કાર્ય, ગુણવત્તા અથવા સુવિધાઓથી જોગવાઈના

સંદર્ભમાં રહેલ કોઈ ખામીઓ, પ્રયોજકના ધ્યાન ઉપર લાવે તો, જ્યાં શક્ય હોય ત્યાં તેવી ખામીઓ પ્રયોજકે પોતાના ખર્ચે સુધારી આપવાની રહેશે અને જો ખામીઓ સુધારવાનું શક્ય ન હોય તો, ફાળવણીથી મેળવનાર અધિનિયમ હેઠળ દર્શાવેલ પ્રક્રિયા મુજબ પ્રયોજક પાસેથી વળતર મેળવવા હકકદાર રહેશે. આ શરતે કે પ્રયોજક તેવા કોઈ કારીગરલક્ષી કાર્યો, ગુણવત્તા અથવા સુવિધાની જોગવાઈમાં રહેલ ખામીઓ અથવા માળખાકીય ખામીઓ માટે જવાબદાર નહીં ઠરે તેના માટે તેઓ જવાબદાર હોય અથવા જે પ્રયોજકના નિયંત્રણ બહાર હોય.

૮. ફાળવણીથી મેળવનારએ રહેણાંકના હેતુ માટે એપાર્ટમેન્ટ અથવા તેનો કોઈ ભાગ જ વાપરવાનો રહેશે તેમજ તેના વપરાશ અંગેની જ મંજૂરી આપવાની રહેશે. તેઓએ પાર્કિંગ અથવા ગેરેજ સ્પેસનો ઉપયોગ માત્ર વાહનો રાખવા અને પાર્ક કરવા માટે જ કરવાનો રહેશે.

૯. ફાળવણીથી મેળવનારે ઈમારતના અન્ય એપાર્ટમેન્ટોના ફાળવણીથી મેળવનારાઓ સાથે મળીને, પ્રયોજક નક્કી કરે તે નામે ઓળખાતી મંડળી અથવા સંઘ અથવા લિમિટેડ કંપનીની રચના કરી તેની નોંધણી કરાવવાની રહેશે અને આ હેતુ માટે વખતોવખત નોંધણી અને/અથવા સભ્ય બનવા માટેની અરજીઓ તેમજ અન્ય દસ્તાવેજો અને લખાણો જે મંડળી અથવા સંઘ અથવા લિમિટેડ કંપનીની રચના અને નોંધણી માટે તેમજ સભ્ય બનવા માટે જરૂરી હોય તે કરવાની રહેશે, જેમાં સુચિત મંડળીના બાય-લોઝનો સમાવેશ થશે અને તેને યોગ્ય રીતે, ભરી, સહી કરીને પ્રયોજકે ફાળવણીથી મેળવનારને આપ્યાની તારખથી સાત-દિવસની અંદર પરત કરવાની રહેશે, જેથી પ્રયોજક ફાળવણીથી મેળવનારાઓની કોમન સંસ્થાની નોંધણી કરાવી શકે. જો સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર અથવા કંપનીઓના રજિસ્ટ્રાર, જે લાગુ પડતું હોય તે, અથવા અન્ય સક્ષમ સત્તામંડળની આવશ્યકતાઓ પ્રમાણે જો કાચા બાય-લોઝ અથવા મેમોરેન્ડમ અને/અથવા ફેરફારો કરવાના થાય તો તે અંગે ફાળવણીથી મેળવનારાએ કોઈ વાંધો ઉપસ્થિત કરવાનો રહેશે નહીં.

૯.૧ એપાર્ટમેન્ટ વપરાશ અને કબજા માટે તૈયાર છે તે અંગેની નોટીસ ફાળવણીથી મેળવનારાને પ્રયોજકે આપ્યાના ૧૫-દિવસની અંદર, પ્રોજેક્ટ જમીન તથા ઈમારતોના સંદર્ભ માં કરવા પડતા ખર્ચ નો પ્રમાણસરનો હિસ્સો જેવો કે સ્થાનિક કરવેરા, સુધારણા કર અથવા સંબંધિત સ્થાનિક સત્તાધિકારી અને/અથવા સરકાર દ્વારા લાદવામાં આવેલ અન્ય કરવેરા, પાણીવેરા, વીમો, કોમન લાઈટ્સ, સમારકામ અને કારકુન, બિલ કલેક્ટર, ચોકીદાર, સફાઈદારના પગારો તેમજ પ્રોજેક્ટ જમીન અને ઈમારતોની

જાળવણી માટે મેનેજમેન્ટને કરવા પડતા તમામ અન્ય આવશ્યક ખર્ચા ઓ ભોગવવા અને ચુકવવા માટે ફાળવણીથી મેળવનારા જવાબદાર રહેશે. જ્યાં સુધી મંડળી અથવા લિમિટેડ કંપનીની રચના ન થાય ત્યાં સુધી, ફાળવણીથી મેળવનારાએ તેવા ખર્ચનો નક્કી કર્યા મુજબનો પ્રમાણસર હિસ્સો પ્રયોજકને ચુકવવાનો રહેશે. ફાળવણીથી મેળવનારા વધુમાં સંમત થાય છે, જ્યાં સુધી ફાળવણીથી મેળવનારાઓ હિસ્સો નક્કી ન થાય ત્યાં સુધી ફાળવણીથી મેળવનારાએ ખર્ચ પેટે માસિક રૂા. નો હંગામી માસિક ફાળો ચુકવી આપવાનો રહેશે. ફાળવણીથી મેળવનારાએ પ્રયોજકને ચુકવેલ તેવી રકમો કોઈ વ્યાજને પાત્ર રહેશે નહીં અને જ્યાં સુધી તે રકમ મંડળી અથવા સંઘ અથવા લિમિટેડ કંપનીને ઉપરોક્ત મુજબ તબદિલ ન કરવામાં આવે ત્યાં સુધી તે પ્રયોજક પાસે રહેશે.

૧૦. ફાળવણીથી મેળવનારાએ કરારમાં દર્શાવ્યા મુજબની રકમોની ચુકવણી કર્યા ઉપરાંત, ફાળવણીથી મેળવનારાએ સદર જગ્યાનો કબજો સોંપ્યા સુધી અથવા તે પહેલાં પ્રયોજકે નક્કી કરેલ ખર્ચની રકમનો પ્રમાણસર હિસ્સો પ્રયોજકને ચુકવી આપવાનો રહેશે અને તે રકમ આ કરારની અન્ય કોઈ જોગવાઈઓમાં આવરી લેવામાં આવશે નહીં.

૧૧. સદર મંડળી અથવા લિમિટેડ કંપની અથવા સર્વોચ્ચ બોડી અથવા ફેડરેશનની રચના કરવા માટે અને તેના નિયમો, નિયમનો અને બાય-લોઝ બનાવવા માટે તેમજ હસ્તાંતરણ લેખ બનાવવા અથવા લીઝની સોંપણી કરવાના સંદર્ભમાં પ્રયોજકના કાયદાકીય એટર્ની/વકીલોની વ્યાવસાયિક ખર્ચ સહિત તમામ અન્ય કાયદાકીય ખર્ચ, ચાર્જ ચુકવવા માટે ફાળવણીથી મેળવનારાએ પ્રયોજકને રૂા./- ની રકમ ચુકવી આપવાની રહેશે.

૧૨. સદર મંડળી અથવા લિમિટેડ કંપની દ્વારા, ઈમારત અથવા ઈમારતના વિભાગના હસ્તાંતરણ લેખ અથવા ભાડાપટ્ટાની નોંધણી કરતી વખતે, ફાળવણીથી મેળવનારાએ પ્રયોજકને સદર ઈમારત/ઈમારતના વિભાગની તબદિલીના તેવા હસ્તાંતરણ અથવા ભાડાપટ્ટા અથવા દસ્તાવેજ અથવા લેખની સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ખર્ચનો તેઓના હિસ્સે આવતો ચુકવવા પાત્ર ખર્ચ ચુકવી આપવાનો રહેશે. સદર સર્વોચ્ચ બોડી અથવા ફેડરેશન દ્વારા પ્રોજેક્ટ જમીનના હસ્તાંતરણ લેખ અથવા ભાડાપટ્ટાની નોંધણી કરતી વખતે, ફાળવણીથી મેળવનારાએ પ્રયોજકને સદર જમીનના માળખાની તબદિલીના તેવા હસ્તાંતરણ અથવા ભાડાપટ્ટા અથવા દસ્તાવેજ અથવા લેખની સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ખર્ચનો તેઓના હિસ્સે આવતો ચુકવવા પાત્ર ખર્ચ ચુકવી આપવાનો રહેશે.

૧૩. પ્રયોજકની રજૂઆતો અને ખાતરીઓ :

પ્રયોજક આથી ફાળવણીથી મેળવનારાને નીચે મુજબની સમજૂતીઓ અને ખાતરીઓ આપે છે.

/૧/ પ્રોજેક્ટ જમીન સંદર્ભે પ્રયોજકે આ કરાર સાથેના ટાઈટલ રીપોર્ટમાં જાહેર કર્યા મુજબ તેઓ પાસે ચોખ્ખા અને વેચાણ લાયક ટાઈટલ છે તેમજ તેઓ પ્રોજેક્ટ જમીન ઉપર વિકાસ કર્યા કરવા અંગેના જરૂરી અધિકાર ધરાવે છે તથા તેઓ પ્રોજેક્ટનું કાર્ય કરવા માટે પ્રોજેક્ટ જમીનનો વાસ્તવિક, ભૌતિક અને કાયદાકીય કબજો ધરાવે છે.

/૨/ પ્રયોજકે પ્રોજેક્ટનો વિકાસ કરવા માટે સક્ષમ સત્તાધિકારીઓ પાસેથી જરૂરી પરવાનગીઓ મેળવેલી છે તેમજ પ્રોજેક્ટનો વિકાસ પુર્ણ કરવા માટે વખતોવખત તેઓએ જરૂરી પરવાનગીઓ મેળવવાની રહેશે.

/૩/ ટાઈટલ રીપોર્ટમાં દર્શાવ્યા સિવાય પ્રોજેક્ટ જમીન ઉપર અથવા પ્રોજેક્ટ ઉપર કોઈ બોજાઓ નથી.

/૪/ ટાઈટલ રીપોર્ટમાં દર્શાવ્યા સિવાય પ્રોજેક્ટ જમીન ઉપર અથવા પ્રોજેક્ટ ઉપર કોઈપણ અદાલત સમક્ષ કોઈ કાર્યવાહીઓ પડતર નથી.

/૫/ સક્ષમ સત્તાધિકારીઓએ પ્રોજેક્ટ, પ્રોજેક્ટ જમીન તેમજ સદર ઈમારત/ વિભાગ સંદર્ભમાં આપેલ મંજૂરીઓ, પરવાનાઓ અને પરવાનગીઓ કાયદેસર અને અસ્તિત્વમાં છે તેમજ કાયદાની પ્રક્રિયા અનુસરીને મેળવવામાં આવેલ છે. વધુમાં પ્રોજેક્ટ, પ્રોજેક્ટ જમીન તેમજ સદર ઈમારત/વિભાગ સંદર્ભમાં સક્ષમ સત્તાધિકારીઓ પાસેથી મેળવવાની થતી તમામ મંજૂરીઓ, પરવાનાઓ અને પરવાનગીઓ કાયદાની પ્રક્રિયા હાથ ધરીને મેળવવાની રહેશે અને પ્રયોજકે, તમામ સમયે પ્રોજેક્ટ, પ્રોજેક્ટ જમીન તેમજ સદર ઈમારત/વિભાગ તથા મઝિયારા વિસ્તારોના સંદર્ભમાં તમામ લાગુ પડતા કાયદાઓનું અનુસર કરેલ છે અને કરવાનું રહેશે.

/૬/ પ્રયોજકને આ કરાર કરવાનો અધિકાર છે તેમજ તેઓએ આ હેઠળ ફાળવણીથી મેળવનારા ઉપસ્થિત થયેલ હકક, અધિકાર અને હિતને પુર્વગ્રહિત અસર થાય તેવા કોઈ કૃત્ય કરેલ નથી અથવા કોઈ કાર્યને અવગણેલ નથી.

/૭/ પ્રયોજકે આ કરાર હેઠળ ફાળવણીથી મેળવનારાના અધિકારોને કોઈપણ પ્રકારે અસર થાય તેવા કોઈ કરારો અને/અથવા વિકાસ કરારો અથવા અન્ય કોઈ કરારો/વ્યવસ્થાઓ અન્ય કોઈ પક્ષકાર અથવા વ્યક્તિ સાથે પ્રોજેક્ટ જમીન, પ્રોજેક્ટ તથા સદર એપાર્ટમેન્ટ/પ્લોટના સંદર્ભમાં કરેલ નથી.

/૮/ પ્રયોજક આથી ખાતરી આપે છે કે પ્રયોજક કોઈપણ પ્રકારે આ કરારમાં જણાવેલ પ્રક્રિયા અનુસાર સદર એપાર્ટમેન્ટ/પ્લોટ ફાળવણીથી મેળવનારાને વેચાણ કરવાથી બાધિત નથી.

/૯/ ફાળવણીથી મેળવનારાઓના સંઘને માળખાનો હસ્તાંતરણ લેખ કરતી વખતે પ્રયોજકે ફાળવણીથી મેળવનારાઓના સંઘને માળખાના મજિયારા વિસ્તારોને કાયદાકીય, ખાલી, શાંત, પ્રત્યક્ષ કબજો સુપ્રત કરવાનો રહેશે.

/૧૦/ પ્રયોજકે બિનતકરારી સરકારી દવાં, રેટ ખર્ચ અને કરવેરા તેમજ અન્ય રકમો, કર ઈમ્પોઝીશન, પ્રિમિયમો, નુકસાની અને/અથવા દંડ તેમજ અન્ય ચુકવવા પાત્ર ખર્ચ, જે હોય તે સદર પ્રોજેક્ટના સંદર્ભમાં સક્ષમ સતાધિકારીઓને ચુકવેલ છે અને ચુકવશે.

/૧૧/ ટાઈટલ રીપોર્ટ જાહેર કર્યા સિવાયની પ્રોજેક્ટ જમીન અને/અથવા પ્રોજેક્ટના સંદર્ભમાં પ્રયોજકને સરકાર અથવા અન્ય કોઈ સ્થાનિક બોડી અથવા સત્તામંડળ અથવા અન્ય લેજિસ્લેટિવ ઈનેક્ટમેન્ટ, સરકારી વટહુકમ, હુકમ, જાહેરનામું(જેમાં સદર મિલકતની જપ્તી અથવા અવલ જપ્તીની નોટીસનો સમાવેશ થાય છે) તરફથી કોઈ નોટીસ મળેલ નથી અથવા બજેલ નથી.

૧૪. ફાળવણીથી મેળવનારાઓ અથવા તેઓ જાતે વ્યક્તિઓના હાથમાં એપાર્ટમેન્ટ આવે તે તમામને લાવવાના હેતુથી, આથી પ્રયોજક સાથે નીચે મુજબ કરાર કરે છે.

/૧/ જે તારીખથી એપાર્ટમેન્ટનો કબજો સંભાળેલ હોય ત્યારથી એપાર્ટમેન્ટને ફાળવણીથી મેળવનારાએ સ્વખર્ચે જાળવવું તેમજ તેને સારી અને રહેવાલાયક સ્થિતિમાં રાખવું તેમજ તેમાં અથવા તે એપાર્ટમેન્ટ જે ઈમારતમાં સ્થિત હોય તેમાં તેવું કોઈ કૃત્ય કરવું નહીં જે નિયમો, નિયમનો અથવા બાય-લોઝથી વિરૂદ્ધ હોય અથવા આવશ્યકતા જણાય તો, સ્થાનિક

સત્તાધિકારીઓની સંમતિ સિવાય એપાર્ટમેન્ટમાં અથવા તે એપાર્ટમેન્ટ જે ઈમારતમાં સ્થિત હોય તેમાં કોઈ ફેરફાર/સુધારા અથવા વધારા કરવા નહીં.

/૨/ એપાર્ટમેન્ટમાં તેવી ચીજવસ્તુઓ રાખવી નહીં જે જોખમી, જવલનશીલ અથવા ભયજનક પ્રકારના હોય અથવા એટલી ભારે હોય કે જેનાથી એપાર્ટમેન્ટ જે ઈમારતમાં સ્થિત હોય તે ઈમારતના બાંધકામ અથવા માળખાને નુકસાન કરે અથવા જે ચીજવસ્તુઓનું સંગ્રહ કરવું સંબંધિત સ્થાનિક અથવા અન્ય સત્તાધિકારી દ્વારા પ્રતિબંધિત કરેલ હોય તેમજ ભારે માલ, જે ઈમારતમાં એપાર્ટમેન્ટ સ્થિત હોય તેમાં, એપાર્ટમેન્ટવાળી ઈમારતના પ્રવેશદ્વાર સહિત તેની દાદર, મઝિયારા વિસ્તારો અથવા અન્ય માળખાને નુકસાન ન કરે તેવી રીતે લાવવા લઈ જવાની કાળજી રાખવી, અને જો એપાર્ટમેન્ટવાળી ઈમારતને અથવા એપાર્ટમેન્ટને ફાળવણીથી મેળવનારાની ભુલના કારણે કોઈ નુકસાન થશે તો, ફાળવણીથી મેળવનારા તેવી નુકસાનીના પરિણામ ભોગવવા માટે જવાબદાર ઠરશે.

/૩/ સદર એપાર્ટમેન્ટના તમામ આંતરિક સમારકારો પોતાના ખર્ચે કરવા અને પ્રયોજકે ફાળવણીથી મેળવનારાને જે સ્થિતિમાં કબજો સુપ્રત કરેલ હોય તે સ્થિતિમાં એપાર્ટમેન્ટની જાળવણી કરવી તેમજ સદર એપાર્ટમેન્ટવાળી ઈમારતમાં અથવા એપાર્ટમેન્ટમાં સંબંધિત સ્થાનિક સત્તામંડળ અથવા અન્ય જાહેર સત્તામંડળના નિયમો અને નિયમનો અને બાય-લોઝથી વિરોધ કોઈ કૃત્ય કરવું/કરાવવું નહીં. ફાળવણીથી મેળવનારા દ્વારા ઉપરોક્ત જોગવાઈના ઉલ્લંઘન કર્યાના કિસ્સામાં, સંબંધિત સ્થાનિક સત્તામંડળ અથવા અન્ય જાહેર સત્તામંડળ સમક્ષ તેના પરિણામો ભોગવવા માટે જવાબદાર ઠરશે.

/૪/ એપાર્ટમેન્ટ અથવા તેના કોઈ ભાગને તોડી પાડી જમીનદોસ્ત કરવું કરાવવું નહીં તેમજ કોઈ સમયે એપાર્ટમેન્ટમાં કોઈપણ પ્રકારના કોઈપણ સુધારા અથવા ફેરફાર કરવા કરાવવા નહીં. તેમજ એપાર્ટમેન્ટવાળી ઈમારતના એલિવેશન તથા બાહ્ય કલર સ્કીમમાં કોઈ ફેરફાર કરવા કરાવવા નહીં તથા ખાસ કરીને એપાર્ટમેન્ટવાળી ઈમારતને ટેકો આપવા અથવા ઈમારતના અન્ય ભાગોનું રક્ષણ કરવા માટે એપાર્ટમેન્ટના પોર્શન, ગટરો, નીક(ડ્રેન) અને પાઈપો તેમજ અન્ય વસ્તુઓને સારી રહેવા લાયક સ્થિતિમાં રાખવી તેમજ એપાર્ટમેન્ટના કોલમ, બીમ, દિવાલો, સ્લેબ અથવા આર.સી.સી. પારડીસ અથવા અન્ય માળખાકીય વસ્તુઓને પ્રયોજક અને /અથવા મંડળી અથવા લીમીટેડ કંપનીની પુર્વલેખિત મંજૂરી મેળવ્યા સિવાય ખોદી/ઠોકીને અથવા અન્ય કોઈ રીતે નુકસાન પહોંચાડવું નહીં.

- /૫/ તેવું કોઈ કૃત્ય કરવું કરાવવું નહીં, જેનાથી પ્રોજેક્ટ જમીનનો તથા એપાર્ટમેન્ટવાળી ઈમારતનો અથવા તેના કોઈ ભાગનો કોઈ વિમો નિરર્થક અને દર ઠરે અથવા જેનાથી વીમાના સંદર્ભમાં કોઈ વધારાના પ્રિમિયમની રકમો ચુકવવા પાત્ર થાય.
- /૬/ સદર એપાર્ટમેન્ટમાંથી કોઈ કુડો, કચરો, ચીથરા, ગંદકી અથવા અન્ય નકામી વસ્તુઓ કમ્પાઉન્ડમાં અથવા પ્રોજેક્ટ જમીનના અન્ય હિસ્સાઓમાં તેમજ જે ઈમારતમાં એપાર્ટમેન્ટ સ્થિત હોય તે ઈમારતમાં ફેંકવી નહીં તેમજ ફેંકવાની મંજૂરી આપવી નહીં.
- /૭/ પ્રયોજકની માંગણીના પંદર દિવસની અંદર, સંબંધિત સ્થાનિક સત્તાધિકારી અથવા સરકાર દ્વારા, જે ઈમારતમાં એપાર્ટમેન્ટ સ્થિત હોય તે ઈમારતમાં પાણી, વીજળી અથવા અન્ય સુવિધાઓ જોડાણો પુરા પાડવા માટે માંગવામાં આવેલ સિક્યોરીટી ડીપોઝીટમાં તેમના હિસ્સે આવતી રકમ પ્રયોજકને ચુકવી દેવી.
- /૮/ સંબંધિત સ્થાનિક સત્તાધિકારી અને/અથવા સરકાર અને/અથવા અન્ય જાહેર સત્તાધિકારી દ્વારા લાદવામાં આવેલ પાણી વેરા, સ્થાનિક વેરા, વીમો તથા તેવા અન્ય કર, જો હોય તો, એપાર્ટમેન્ટના ભોગવટેદારના બદલવાના કારણે અથવા અન્ય કોઈ હેતુઓ માટે, સિવાય કે જે હેતુ માટે તેને વેચાણ કરેલ હોય, તેમાં થયેલ વધારાની રકમ ચુકવવી અને ભોગવવી.
- /૯/ જ્યાં સુધી આ કરાર હેઠળ ફાળવણીથી મેળવનારા દ્વારા પ્રયોજકને ચુકવવા પાત્ર થતી તમામ રકમો ચુકવી દેવામાં ન આવે ત્યાં સુધી ફાળવણીથી મેળવનારાએ કોઈને ભાડે, પેટા-ભાડે અથવા તબદિલ, સુપ્રત અથવા હિતમાં ભાગીદારી અથવા આ કરારના બેનિફીટ ફેક્ટરમાં હિસ્સેદારી અથવા એપાર્ટમેન્ટના કબજામાં હિસ્સેદારી કરવાની રહેશે નહીં.
- /૧૦/ ફાળવણીથી મેળવનારાએ મંડળી અથવા લિમિટેડ કંપની સર્વોચ્ચ બોડી અથવા ફેડરેશન દ્વારા શરૂઆતમાં ઘડવામાં આવેલ તમામ નિયમો અને નિયમોનું પાલન કરવાનું રહેશે તેમજ સદર ઈમારત અને એપાર્ટમેન્ટોના રક્ષણ અને જાળવણી માટે વખતોવખત તેમાં કરવામાં આવેલ સુધારા-વધારા અથવા ફેરફારોનું પણ પાલન કરવાનું રહેશે તથા સંબંધિત સ્થાનિક સત્તાધિકારી અને સરકાર અને અન્ય જાહેર બોડીઓના જે તે વખતના નિયમો, નિયમનો, અને બાય-લોઝનું પણ પાલન કરવાનું રહેશે. ફાળવણીથી મેળવનારાએ મંડળી/લીમિટેડ કંપની/સર્વોચ્ચ બોડી/ ફેડરેશન દ્વારા કબજા તથા ઈમારતના એપાર્ટમેન્ટના વપરાશ અંગે

પ્રસ્થાપિત કરેલ મર્યાદાઓ અને શરતોનું પણ પાલન કરવાનું રહેશે તેમજ આ કરારની શરતો અનુસાર કરવેરા, ખર્ચ અથવા અન્ય ખર્ચાઓમાં નિયમિત રીતે અને સમયસર ફાળો આપવાનો રહેશે.

/૧૧/ ફાળવણીથી મેળવનારાએ પ્રયોજકને તથા તેમના સર્વેયરો અને એજન્ટો, કારીગરો તથા અન્યોની સાથે અથવા વિના, તમામ વ્યાજબી સમયે, સદર ઈમારતો અથવા તેના કોઈપણ હિસ્સાઓમાં પ્રવેશ કરવા અને તેની સ્થિતિ તપાસવા માટે આપવાની પરવાનગી આપવાની રહેશે.

/૧૨/ ફાળવણીથી મેળવનારાએ પ્રયોજકને તથા તેમના સર્વેયરો અને એજન્ટો, કારીગરો તથા અન્યોની સાથે અથવા વિના, તમામ વ્યાજબી સમયે, પ્રોજેક્ટ જમીન અથવા તેના કોઈપણ હિસ્સાઓમાં પ્રવેશ કરવા અને તેની સ્થિતિ તપાસવા માટે આપવાની પરવાનગી આપવાની રહેશે.

૧૫. પ્રયોજકે ફાળવણીથી મેળવનારા પાસેથી એડવાન્સ અથવા ડીપોઝીટ પેટે મેળવેલ રકમો, સહકારી મંડળી અથવા સંઘ અથવા કંપનીના પ્રચાર અંગે મેળવેલ મુદ્દીની રકમ અથવા ખર્ચ, કાયદાકીય ખર્ચ પેટે મેળવેલ રકમો અંગે એક અલગ ખાતું જાળવવાનું રહેશે અને જે હેતુ માટે તે રકમ મેળવેલ હોય તે હેતુ અંગે જ ખર્ચ કરવાનો રહેશે.

૧૬. આ કરારમાં જણાવેલ કોઈપણ સદર એપાર્ટમેન્ટો અથવા સદર પ્લોટ અને ઈમારત અથવા તેના કોઈપણ હિસ્સા માટે કોઈ કાયદાકીય મંજૂરી, મરણ અથવા સોંપણી વ્યક્ત કરતું નથી તેમજ માનવાનું નથી. ફાળવણીથી મેળવનારાને આથી વેચાણ કરવામાં આવેલ એપાર્ટમેન્ટના સંદર્ભમાં તેમજ તમામ ખુલ્લી જગ્યાઓ, પાર્કિંગની જગ્યાઓ, લોબીઓ, દાદર, અગાશી, રીક્રિએશન જગ્યાઓ અંગે કોઈ દાવો/માંગણું રહેશે નહીં અને તે જ્યાં સુધી ઉપરોક્ત જણાવ્યમ મુજબ તબદીલ ન થાય ત્યાં સુધી પ્રયોજકની મિલ્કત રહેશે.

૧૭. પ્રયોજકે ગીરો કરવાનું નથી તેમજ કોઈ બોજો ઉપસ્થિત કરવાનો નથી તે અંગે પ્રયોજકે આ કરાર કર્યા પછી એપાર્ટમેન્ટ ઉપર કોઈ ગીરો કરવાનો નથી અથવા કોઈ બોજો ઉપસ્થિત કરવાનો નથી અને જો કોઈ ગીરો અથવા બોજો ઉપસ્થિત કરેલ હોય તો જે તે વખતે અમલમાં રહેલ કોઈપણ કાયદામાં કાંઈપણ સમાવિષ્ટ હોય તે છતાં, તેવો ગીરો અને બોજો, તેવા એપાર્ટમેન્ટ/પ્લોટ લેવા માટે સંમત થયેલ ફાળવણી મેળવનારાના અધિકાર અને હિતને અસર કરશે નહીં.

૧૮. બંધનકારક અસર :

પ્રયોજક દ્વારા ફાળવણીથી મેળવનારાને આ કરાર આપવાથી પ્રયોજક અથવા ફાળવણીથી મેળવનારા ઉપર તેની બંધનકારક અસર થશે નહીં, જ્યાં સુધી પ્રથમ તો, સ્વીકૃતિની તારીખથી ૩૦(ત્રીસ) દિવસની અંદર ફાળવણીથી મેળવનારા આ કરારને તેના તમામ પરિશિષ્ટો સાથે તેમજ ચુકવણીના પ્લાનમાં નિર્દિષ્ટ કરેલ ચુકવણીઓ સાથે સહી કરીને મોકલી આપે અને બીજું કે તેઓ પ્રયોજકની સુચના મુજબ સંબંધિત સબ-રજિસ્ટ્રાર સમક્ષ તેની નોંધણી માટે હાજર રહે. જો ફાળવણીથી મેળવનારા(ઓ) તેઓ દ્વારા થયેલ સ્વીકૃતિના ૩૦ દિવસની અંદર આ કરારને પ્રયોજકને પરત મોકલી આપવામાં અને/અથવા તેની નોંધણી માટે પ્રયોજક દ્વારા જ્યાં અને જ્યારે બોલાવવામાં આવે ત્યાં હાજર રહેવામાં નિષ્ફળ જાય તો પ્રયોજકે ફાળવણીથી મેળવનારાને સદર કસુરને સુધારવા અંગેની નોટીસ પાઠવવાની રહેશે અને જો તેવી ભુલને ફાળવણીથી મેળવનારા દ્વારા સદર નોટીસની સ્વીકૃતિના ૧૫-દિવસની અંદર સુધારવામાં ન આવે તો ફાળવણીથી મેળવનારાની અરજીને રદ ગણવાની રહેશે અને ફાળવણીથી મેળવનારાએ તે સંદર્ભે બુકિંગની રકમ સહિત ચુકવેલ તમામ રકમો ફાળવણીથી મેળવનારાને કોઈપણ વ્યાજબ અથવા વળતર સિવાય પરત આપી દેવાની રહેશે.

૧૯. સંપૂર્ણ કરાર :

આ કરાર, તેના પરિશિષ્ટો અને એનેક્ષરો સહિત, ઉપરોક્ત વિષય વસ્તુ અંગેનો પક્ષકારો વચ્ચેનો એક સંપૂર્ણ કરાર બનાવે છે જે સદર એપાર્ટમેન્ટ/પ્લોટ/ઈમારત જે લાગુ પડતું હોય તે અંગે પક્ષકારો વચ્ચે થયેલ કોઈપણ અને તમામ લેખિત અથવા મૌખિક બાંહેધરીઓ, સમજુતીઓ, અન્ય કોઈ કરારો, ફાળવણીપત્ર, પત્રવ્યવહારો, વ્યવસ્થાઓથી ઉપરવટ રહેશે.

૨૦. ફેરફાર કરવાના અધિકાર અંગે :

આ કરાર માત્ર પક્ષકારોની લેખિત સંમતિથી જ સુધારી શકાશે.

૨૧. આ કરારની જોગવાઈઓ ફાળવણીથી મેળવનારા/ત્યાર પછીના ફાળવણીથી મેળવનારાઓને લાગુ પડવા અંગે :

બંને પક્ષકારોને સ્પષ્ટપણે સમજણ થયેલ છે અને તેઓ સંમત થયેલ છે કે પ્રોજેક્ટના સંદર્ભમાં નિર્દિષ્ટ તમામ જોગવાઈઓ અને આ હેઠળ ઉપસ્થિત થતી તમામ જવાબદારીઓ, તબદીલીના કિસ્સામાં એપાર્ટમેન્ટ/પ્લોટના કોઈપણ હવે પછીના ફાળવણીથી મેળવનારાઓને પણ સમાન રીતે

લાગુ પડશે તેમજ અસર કરશે, કારણ કે સદર જવાબદારીઓ તેના તમામ ઉદ્દેશો અને હેતુઓ માટે એપાર્ટમેન્ટ/પ્લોટ સાથે જ જશે.

૨૨. સમાંતરતા :

આ કરારની કોઈપણ જોગવાઈ અધિનિયમ અથવા તે હેઠળ ઘડેલ નિયમો અને નિયમનો હેઠળ અથવા અન્ય કોઈ લાગુ પડતા કાયદાઓ હેઠળ રદ અને બિનઅસરકારક જણાઈ આવે તો કરારની તેવી જોગવાઈઓને કરારના હેતુ સાથે વ્યાજબી રીતે અસંગત થાય તેમજ અધિનિયમ અથવા તે હેઠળ ઘડેલ નિયમો અને નિયમનો અથવા લાગુ પડતા કાયદા, જે લાગુ પડતું હોય તેને અનુકુળ રહે તેટલી હદે સુધારેલ અથવા રદ કરેલ ગણવાની રહેશે અને કરારની બાકીની લાગુ પડતી જોગવાઈઓ કરાર કરતી વખતે યોગ્ય અને અસરકારક રહેશે.

૨૩. આ કરારમાં જ્યાં પણ પ્રમાણસરના હિસ્સાનો સંદર્ભ કરેલ હોય તેની ગણતરીની પદ્ધતિ અંગે :

આ કરારમાં જ્યાં પણ એવું નિયત કરેલ હોય કે ફાળવણીથી મેળવનારાએ પ્રોજેક્ટના અન્ય ફાળવણીથી મેળવનારા(ઓ) સાથે મજિયારી રીતે કોઈપણ જાતની ચુકવણી કરવાની રહેશે ત્યાં તેવી ચુકવણી પ્રોજેક્ટના તમા એપાર્ટમેન્ટ/પ્લોટના કુલ કાર્પેટ એરિયામાંથી સદર એપાર્ટમેન્ટ/પ્લોટના કાર્પેટ એરિયાના પ્રમાણમાં ગણવાની રહેશે.

૨૪. વધુ ખાતરીઓ :

બંને પક્ષકારો સંમત થાય છે કે, અહીં સ્પષ્ટપણે જણાવેલ હોય તેવા કરાર અને પ્રવૃત્તિઓ ઉપરાંત, આ કરારની જોગવાઈઓને અસરમાં લાવવા માટે અથવા આ હેઠળ ઉપસ્થિત કરવામાં આવેલ અથવા તબદીલ કરવામાં આવેલ કોઈપણ અધિકારને કાયમ કરવા માટે અથવા અન્ય તેવા વ્યવહારો સંદર્ભે વ્યાજબી રીતે આવશ્યક હોય તેવા અન્ય કરારો અને પ્રવૃત્તિઓ કરી આપવાની રહેશે.

૨૫. કરાર કરવાનું સ્થળ :

આ કરારનું અમલીકરણ ત્યારે જ પુર્ણ ગણવામાં આવશે જ્યારે પ્રયોજકની ઓફિસમાં, અથવા પ્રયોજક અને ફાળવણીથી મેળવનારા વચ્ચે સંમતિથી નક્કી થયેલ અન્ય જગ્યાએ, માં ફાળવણીથી મેળવનારા અને પ્રયોજક વચ્ચે યોગ્ય રીતે કરાર થયા બાદ પ્રયોજક તેઓના અધિકૃત સહીકર્તા દ્વારા કરાર પુર્ણ કરે અથવા તેના અમલીકરણની સાથોસાથ સદર કરારની નોંધણી સબ-રજિસ્ટ્રાર કચેરીમાં આવે તેથી આ કરારને મુકામે કરવામાં આવે છે તેમ ગણાશે.

૨૬. ફાળવણીથી મેળવનારા અને/અથવા પ્રયોજકે આ કરારને તેમજ હસ્તાંતર/ ભાડાપટ્ટાની સોંપણી સાથે યોગ્ય નોંધણીની કચેરીમાં નોંધણી અધિનિયમમાં નિયત કરેલ સમયમર્યાદામાં રજુ કરવાનો રહેશે તથા પ્રયોજક તેવી કચેરીએ હાજર રહેશે અને તેના અમલીકરણ સ્વીકૃતિ આપશે.

૨૭. આ કરાર મુજબની ફાળવણીથી મેળવનારા અને પ્રયોજકને બજવવામાં આવતી તમામ નોટીસો તેઓને યોગ્ય રીતે બજેલ છે તેવું ગણવામાં આવશે જો સદર નોટીસ ફાળવણીથી મેળવનારા અથવા પ્રયોજકને રજી.પોસ્ટ એ.ડી.થી તેમજ જણાવેલ ઈ-મેઈલ આઈડી ઉપર/ પોસ્ટના પ્રમાણપત્ર હેઠળ તેઓના નીચે મુજબના સરનામાઓ ઉપર બજવણી કરેલ હશે.

..... ફાળવણી મેળવનારાનું નામ

..... ફાળવણી મેળવનારાનું સરનામું

જણાવેલ ઈમેલ-આઈડી :

" શ્રીજી બિલ્ડર્સ" ના અધિકૃત ભાગીદાર (૧) શ્રી શૈલેષકુમાર કરશનભાઈ બુટાણી, (૨) શ્રી પુનીતકુમાર મગનભાઈ બુટાણી, (૩) શ્રી દિનેશભાઈ લીલાભાઈ બફલીપરા, (૪) શ્રી કપીલભાઈ કેશવભાઈ અંકોલા, (૫) શ્રી જયંતીલાલ નાથાભાઈ કાવઠીયા, (૬) શ્રી સંજય ગોરધનભાઈ જાકાસણીયા, (૭) શ્રી દિવ્યાબેન બાબુલાલ ડેડકીયા, (૮) શ્રી રશ્મિ પ્રવિણ પટેલ, (પાનકાર્ડ નં.AECFS3699R), પેઢીનું સરનામું. અક્ષર પ્લાઝા-૨, પહેલા માળે, ઝાંઝરડા ક્રોસ રોડ નજીક, બાયપાસ, જુનાગઢ, ગુજરાત-૩૬૨૦૦૧

ઈમેલ-આઈડી : savanresidency.01@gmail.com

કરાર થયા પછી ઉપરોક્ત જણાવેલ નોંધાયેલ સરનામાઓ ઉપર પ્રયોજક અને ફાળવણીથી મેળવનારાએ એકબીજાના તેઓના સરનામામાં થયેલ કોઈપણ ફેરફારની જાણ કરવી તેઓની ફરજ રહેશે, જો તેમ કરવામાં ન આવે તો ઉપરોક્ત સરનામે મોકલેલ તમામ પત્રો અને સંચાર પ્રયોજક

અથવા ફાળવણીથી મેળવનારા, જે લાગુ પડતું હોય તેઓને બજી ગયેલ છે તેમ માની લેવામાં આવશે.

૨૮. સંયુક્ત ફાળવણીથી મેળવનારાઓ :

સંયુક્ત ફાળવણીથી મેળવનારાઓના કિસ્સામાં, પ્રયોજક દ્વારા કરવામાં આવેલ તમામ સંચાર, જે ફાળવણીથી મેળવનારાનું નામ પ્રથમ જણાવેલ હોય તેને તેઓ દ્વારા આપવામાં આવેલ સરનામે મોકલવાનું રહેશે જે તમામ ઉદ્દેશો અને હેતુઓ માટે તમામ ફાળવણીથી મેળવનારાઓ ઉપર બજી ગયેલ છે તેમ માનવાનું રહેશે.

૨૯. સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી :

આ કરારના સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણીનો ખર્ચ ફાળવણીથી મેળવનારાએ ભોગવવાનો રહેશે.

૩૦. તકરાર નિવારણ :

પક્ષકારો વચ્ચે થયેલ કોઈપણ તકરારનો સમાધાનથી ઉકેલ લાવવાનો રહેશે. જો સમાધાન શક્ય ન હોય તો, તકરારને રીયલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ)એક્ટ, ૨૦૧૬ની જોગવાઈઓ તેમજ તે હેઠળ ઘડેલ નિયમનો હેઠળ ગુજરાત રીયલ એસ્ટેટ નિયમનકારી સત્તામંડળ તરફ સંદર્ભ કરવાનો રહેશે.

૩૧. નિયંત્રિત કાયદો :

આ કરાર હેઠળ અને દ્વારા ઉપસ્થિત થતાં પક્ષકારોના અધિકારો અને જવાબદારીઓ જે તે વખતે અમલમાં રહેલ ભારતના કાયદાઓ હેઠળ ઉપસ્થિત થયેલ ગણવાના રહેશે અને અદાલતોને આ કરાર અંગેની હકુમત રહેશે.

ઉપરોક્ત નામવાળા પક્ષકારોએ આજરોજ મુકામે (શહેરનું નામ) સાક્ષીઓ રૂબરૂ આ વેચાણ કરારમાં સહી મતા કરી આપેલ છે.

ઉપરોક્ત સંદર્ભ કરેલ પ્રથમ પરિશિષ્ટ, સ્વતંત્ર માલિકીની/ભાડાપટ્ટાવાળી જમીનનું વર્ણન તેમજ અન્ય તમામ વિગતો.

ઉપરોત સંદર્ભ કરેલ બીજું પરિશિષ્ટ મઝિયારા વિસ્તારો અને સુવિધાઓની પ્રકૃતિ, હદ અને વર્ણન દર્શાવે છે

પરિશિષ્ટ 'એ'

જુનાગઢ જીલ્લાના જુનાગઢ તાલુકાના મુખ્ય શહેર જુનાગઢમાં મહાનગરપાલીકા હદમાં જુનાગઢ ના રેવન્યુ સરવે નંબર-૧૨૨/૨/પી-૧/પી-૨ એકર ૧-૨૪ ગુંઠા ક્ષેત્રફળ વાળી જમીન કે જે રહેણાંકના હેતુ માટે બીનખેતીમાં ફેરવાયેલ છે અને તે "હરીઓમનગર-બી" નામે ઓળખાતી બીનખેતી થયેલ જમીનના લે-આઉટ પ્લાનમાં જણાવેલ પ્લોટો પૈકી પ્લોટ નંબર-૧, ચો.મીટર ૧૫૫૪-૭૫ ના ચો.વાર ૧૮૫૯-૪૮ આ. તથા પ્લોટ નંબર-૨ ની જમીન ચો.મીટર ૧૦૮૮-૭૮ ના ચો.વાર ૧૩૦૨-૧૮ આ. મળી કુલ જમીન ચો.મીટર ૨૬૪૩-૫૩ આ. ક્ષેત્રફળ ધરાવતી જમીન તથા તેના ઉપર રહેણાંક હેતુ માટે બાંધવામાં આવેલ ઈમારત જે "સવન રેસીડેન્સી-એ", "સવન રેસીડેન્સી-બી", "સવન રેસીડેન્સી-સી" ના નામથી ઓળખાય છે.

ચર્તુ:સીમાં

પુર્વ :-

પશ્ચિમે :-

ઉત્તરે :-

દક્ષિણે :-

ગ્રાઉન્ડ ફ્લોર થી ફીર્થ ફ્લોર :- જેમા ૧ બિલ્ડીંગ માં ગ્રાઉન્ડ ફ્લોર થી સેવન ફ્લોર પર રહેણાંક હેતુ માટે ફ્લેટ/પ્લોક સીડી, લીફ્ટ તથા પેસેજનું બાંધકામ કરેલ છે. જેમા ગ્રાઉન્ડ ફ્લોર પાર્કીંગ તેમજ ફર્સ્ટ ફ્લોરથી સેવન ફ્લોરમાં એક માળે- ૪(ચાર) ફ્લેટ/પ્લોક મળી ટોટલ ૨૮ (અઠીયાવીસ) ફ્લેટ/પ્લોકનું બાંધકામ કરેલ છે. અને આમ ત્રણ બિલ્ડીંગ મળી ટોટલ ૮૪ (ચોરચાસી) ફ્લેટ/પ્લોકનું બાંધકામ કરેલ છે.

પરિશિષ્ટ 'બી'

મઝીયારા વિસ્તારો અને સુવિધાઓનું વર્ણન :

- લીફ્ટ
- કોમન પેસેજ
- કોમન પાર્કિંગ
- અંડર ગ્રાઉન્ડ એન્ડ ઓવરહેડ વોટર ટેન્ક.

એનેક્ષર—એ

(સંબંધિત સ્થાનિક સત્તામંડળે મંજૂર કરેલ અને ફાળવણીથી મેળવનારાએ ખરીદ કરવા સંમત થયેલ એપાર્ટમેન્ટના પ્લાનો અને સ્પષ્ટીકરણની પ્રમાણિત નકલો)

એનેક્ષર—બી

રીયલ એસ્ટેટ નિયમનકારી સત્તાધિકારીએ મંજૂર કરેલ પ્રોજેક્ટના નોંધણી પ્રમાણપત્રની પ્રમાણિત નકલ.

એનેક્ષર-સી

મુખ્યવિશેષતાઓ :

- પાર્કીંગ :- ચેકડ સ્ટાઈલ્સ સાથે
- ફ્લોરીંગ :- ફુલ્લી વિટ્રીફાઈડ
- ગ્લેઝડ :- ક્રિયન, ટોયલેટ, બાથમાં ફુલ ગ્લેઝડ
- ક્રીયન :- સેન્ડવીચ પ્લેટ ફોર્મ સ્ટીલ સીક સાથે
- ડોર :- મેઈન ડોર ડેકોરેટીવ તથા અન્ય ફલસ ડોર
- વિન્ડો :- એલ્યુમીનીયમ સેક્સન ગ્રીલ સાથે
- પ્લમ્બીંગ :- આઈ.એસ.આઈ. કંપનીનું ફીટીંગ
- વોટર સપ્લાય :- પાણી સ્ટોરેજ માટે અંડરગ્રાઉન્ડ તેમજ ઓવર હેડ ટેંક
- ઈલેક્ટ્રીક :- આઈ.એસ.આઈ. કંપનીનું કન્સીલ્ડ વાયરીંગ પુરતા પોઈન્ટ સાથે.
- કલર :- અંદરના ભાગે લાપી અસ્તર બહારના ભાગે પ્લાસ્ટીક પેઈન્ટ

ઉપરોક્ત ફાળવણીથી મેળવનારા પાસેથી રૂા. ની રકમ કરાર કરતાં સમયે અર્નેસ્ટ મની ડીપોઝીટ અથવા અરજીની ફી તરીકે ઓમને મળેલ છે હું સ્વીકૃતિ આપુ છું.

—પ્રયોજક

નીચે જણાવેલ વ્યક્તિઓના હસ્તાક્ષરમાં

ફોટોગ્રાફ
લગાવી તેની
ઉપર સહી
કરવી

ફોટોગ્રાફ
લગાવી તેની
ઉપર સહી
કરવી

ફાળવણીથી મેળવનારા : (સંયુક્ત ખરીદનાર સહીત)

(૧)-----

(૨)-----

મુકામ : તારીખ :

સાક્ષીઓની હાજરીમાં :

૧. નામ

સહી

૨. નામ

સહી

નીચે જણાવેલ વ્યક્તિઓના હસ્તાક્ષરમાં
પ્રયોજક : શ્રીજી બિલ્ડર્સ" ના અધિકૃત ભાગીદાર

- (૧) શ્રી શૈલેષકુમાર કરશનભાઈ બુટાણી,
 - (૨) શ્રી પુનીતકુમાર મગનભાઈ બુટાણી,
 - (૩) શ્રી દિનેશભાઈ લીંબાભાઈ બફલીપરા,
 - (૪) શ્રી કપીલભાઈ કેશવભાઈ અંકોલા,
 - (૫) શ્રી જયંતીલાલ નાથાભાઈ કાવઠીયા,
 - (૬) શ્રી સંજય ગોરધનભાઈ જાકાસણીયા,
 - (૭) શ્રી દિવ્યાબેન બાબુલાલ ડેડકીયા,
 - (૮) શ્રી રશ્મિ પ્રવિણ પટેલ,
- (પાનકાર્ડ નં.AECFS3699R),

ફોટોગ્રાફ લગાવી
તેની ઉપર સહી
કરવી

(૧)-----
(અધિકૃત હસ્તાક્ષરતા)

સાક્ષીઓ :

નામ

સહી

નામ

સહી

નોંધ : કરારના પક્ષકારોની પ્રકૃતિના સંદર્ભમાં દરેક વ્યક્તિગણ કિસ્સામાં
અમલીકરણના મુદ્દાઓ નક્કી કરવા.